



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦



તા.૧૦/૮/૨૦૧૪ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધીધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૬૧/૧૪

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૫ કેસ કરી ૧૮ વ્યક્તિઓને ઝડપી ૮૩ લીટર દેશી દારૂ, ૧૦૦ લીટર વોશ, ૮૩ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૮૦ ક્વોટર ઈંગ્લીશ દારૂ અને ૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૦૨ કેસ કરી ૧૬ વ્યક્તિઓને ઝડપી રૂપિયા ૭૫,૩૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૦૬૨/૧૪

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૭૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૭ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ખુનની કોશીષ :-

સમાચાર યાદી નં.૨૦૬૩/૧૪

ઇસનપુર : શાનુ અકબરભાઈ શેખ (ઉ.વ.૨૦)(રહે.અમ્મા મસ્જીદ સામે, કર્ણાટક ગલી, ચંડોળા તળાવની પાળ, શાહઆલમ ઇસનપુર) એ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૯/૮/૧૪ રાતનાં ૯/૦૦ વાગ્યાના સુમારે શાહઆલમ, કર્ણાટક મસ્જીદની બહાર પોતે બેઠા હતા દરમ્યાન આરોપી (૧)અલ્તાફ મેહબુબભાઈ અને (૨)સોનુ મેહબુબભાઈ (બન્ને રહે.ચંડોળા તળાવની પાળે, શાહઆલમ ઇસનપુર) નાઓએ અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી અલ્તાફે તલવાર જેવા તિક્ષ્ણ હથેલીયારનો એક ફટકો શાનુના માથાના વચ્ચેના ભાગે મારી તથા સોનુએ પાછપ લઈ શાનુની આંખની ભ્રમરના ઉપરના ભાગે ફટકો મારી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની કોશીષ કરી બંને આરોપીઓ નાસી ગયેલ છે. આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.ડી.ચૌધરી ચલાવે છે.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૨૦૬૪/૧૪

વટવા : અર્પિતાબહેન નવીનભાઈ ગાભાવાલા (રહે.ઉમંગ ફ્લેટ, રંગોલીનગરની બાજુમાં, નારોલ કોર્ટની પાછળ, વટવા) એ તા.૯/૮/૧૪ નારોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧/૮/૧૪ રાતનાં ૯/૩૦ થી તા.૯/૮/૧૪ સવારનાં ૯/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના મકાનની રસોડાની બારીનો કાચ ખોલી બારીમાંથી અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તેમજ વસ્તુઓ મળી કુલ રૂપિયા ૭૪,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.આર.પરમાર ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૨૦૬૫/૧૪

સોલા ફાઇકોર્ટ : હેતલબહેન જયેશભાઈ પટેલ (રહે.હરભોળાનાથ પાર્ક સોસાયટી, નેશનલ હાઇવે-૮, ઓઢવ) એ તા.૯/૮/૧૪ નારોજ સોલા ફાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૭/૮/૧૪ સવારનાં ૧૦/૧૫ થી ૧૦/૪૦ વાગ્યા દરમ્યાન વાડજથી ઓટોરીક્ષામાં બેસી ચાંદલોડીયા વી.ટી.પાર્ક સોસાયટી ખાતે જવા સારૂ નિકળ્યા હતા દરમ્યાન પોતાની પાસેની થેલામાં મુકેલ લેડીઝ પર્સમાંથી કોઈ અજાણી વ્યક્તિએ હેતલબહેનની નજર ચુકવી સોનાનાં દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા ૪૬,૦૦૦/- મતાની ચોરી કરી લીધી હતી. આ ગુનાની તપાસ હે.કો.શ્રી રમણજી રામાજી ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૨૦૬૬/૧૪

વટવા : કોકીલાબહેન રોહિતભાઈ ચુનારા (રહે.આશાપુરીનગર, બળીયાદેવના મંદિરની સામે, વટવા) એ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે કે તા.૯/૮/૧૪ બપોરના ૧/૩૦ વાગ્યાના સુમારે વટવા રીંગ રોડ, ગરનાળા પાસે હાઇ-વે ઉપર પોતાના પતિ સાથે મોટર સાયકલ ઉપર બેસી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન કાર નંબર જીજે.૧.આર.સી.૫૨૧૪ ના ચાલકે મોટર સાયકલને પાછળથી ટક્કર મારતાં કોકીલાબહેન તથા તેમના પતિ રોહિતભાઈ (ઉ.વ.૪૫) નીચે પડી જતાં રોહિતભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે અજાણ્યો કાર ચાલક પોતાની કાર સ્થળ ઉપર મુકી નાસી ગયો હતો. રોહિતભાઈને સારવાર અર્થે વા.સા.હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરનાં ડૉ.શ્રીએ રોહિતભાઈને મૃત જાહેર કર્યા હતા. આ ગુનાની તપાસ મ.સ.ઈ.શ્રી પ્રકાશભાઈ ખીમજીભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર
પોલીસ કમિશનર વતી.